

—:: કબજા વગરનું સાટાખત ::—

સંવત ૨૦૭૭ના_____ને વાર : _____, તારીખ : _____, માહે : _____, સને :
૨૦૨૧ ના અંગ્રેજી દિને . . .

આ સાટાખત લખાવી લેનારા યાને વેચાણ લેનારા ::—

જાતના : _____, ઉ.આ.વ.: _____, ધંધો : _____,
રહેવાસી :

તે પહેલા પક્ષના. . .

જોગ લી...

આ સાટાખત લખી આપનારા યાને વેચાણ આપનારા ::—

રાજહંસ ઈન્ફ્રાકોન (ઈન્ડિયા) પ્રા. લિ. – P.A.NO. AAECR 6784R -

જે કંપની કાયદા અન્વયે રજીસ્ટર્ડ થયેલ કંપની છે અને જેની રજી. ઓફીસ : રાજહંસ એમ્પાયર,
હોટલ લી-મેરીડીયનની પાસે, સુરત ડુમસ એરપોર્ટ રોડ, મગદલા, સુરત મુકામે આવેલ છે.

તે બીજા પક્ષના. . .

હવે પછી પહેલા પક્ષનાઓનો સરળતા ખાતર 'પહેલા પક્ષના', 'એલોટી', 'વેચાણ
રાખનાર', 'ખરીદનાર', 'વેચાણ લેનાર' તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે તેમજ બીજા
પક્ષનાઓનો સરળતા ખાતર 'બીજા પક્ષના', 'પ્રમોટર', 'વેચાણ આપનાર', 'પ્રયોજક', 'વેચનાર'
તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે.

તેમજ પ્રમોટર તથા એલોટીને સંયુક્ત રીતે "પક્ષકારો" તથા વ્યક્તિગત રીતે "પક્ષકાર"
તરીકે ઓળખવામાં આવશે.

જત હમો બીજા પક્ષના તમો પહેલા પક્ષનાને આ સાટાખત લખી આપી જણાવીએ છીએ,
જેની શરતો નીચે મુજબ છે.

—:: સાટાખતની શરતો ::—

- (1) શહેર સુરત, તાલુકો મજુરાના મોજે ગામ પીપલોદના
રેવન્યુ સરવે નંબર-૬૪/૧/પૈકી ૨, ૬૪/૧/પૈકી ૩ તથા ૬૪/૧/પૈકી ૪ થી નોંધાયેલી
બીનખેતીની જમીન કે જેનું સંયુક્ત ક્ષેત્રફળ ૪૩૦૫ સમયોરસમીટર
છે તે જમીનને ટી.પી.સ્કીમ નંબર-૬ (પીપલોદ) લાગુ પડતાં ફાયનલ પ્લોટ

નંબર-૪૭ તથા ઓરીજીનલ પ્લોટ નંબર-૧૪/એ ફાળવવામાં આવેલ, જેનું ફાયનલ પ્લોટ મુજબનું ક્ષેત્રફળ ૨૮૪૭ ચો.મી. વાળી બીનખેતીની જમીન તથા શહેર સુરત, તાલુકો મજુરાના મોજે ગામ પીપલોદના રેવન્યુ સરવે નંબર-૬૨/પૈકી ૨, ૬૨/પૈકી ૩, ૬૨/પૈકી ૪ તથા ૬૨/પૈકી ૫ થી નોંધાયેલી બીનખેતીની જમીન કે જેનું સંયુક્ત ક્ષેત્રફળ ૪૩૫૬ સમયોરસમીટર છે તે જમીનને ટી.પી.સ્કીમ નંબર-૬ (પીપલોદ) લાગુ પડતાં ફાયનલ પ્લોટ નંબર-૬૪ તથા ઓરીજીનલ પ્લોટ નંબર-૧૫ ફાળવવામાં આવેલ, જેનું ફાયનલ પ્લોટ મુજબનું ક્ષેત્રફળ ૩૦૩૨ ચો.મી. વાળી બીનખેતીની જમીનો હમો બીજા પક્ષનાએ જમીન માલિકો પાસેથી રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ નંબર : થી તા. ના રોજથી અલગ-અલગ દસ્તાવેજોથી ખરીદ કરેલ છે અને સદર જમીનમાં "રાજહંસ કોર્નેલો" ના નામથી યોજનાનું આયોજન કરેલ છે અને "રાજહંસ કોર્નેલો"ના નામથી આયોજીત યોજનામાં આવેલ યુનિટો પૈકી નીચે શિડયુલ-૧ માં જણાવેલ યુનિટ પહેલા પક્ષનાએ બીજા પક્ષના પાસેથી વેચાણ રાખવાનું નક્કી કરેલું છે. જેને હવે પછી સરળતા ખાતર "ફ્લેટ", "યુનીટ", "મિલકત", "સદરહુ મિલકત", "વેચાણ આપેલ મિલકત" તરીકે પણ સંબોધવામાં આવેલ છે. શિડયુલ-૧ માં એલોટીને વેચાણ આપેલ યુનિટનું વર્ણન કરવામાં આવેલ છે તેમજ શિડયુલ-૨ માં વેચાણ આપેલ યુનિટ સાથે સમગ્ર યોજનામાં તમામ યુનિટ હોલ્ડરોને આપવામાં આવેલ રાસુકી વપરાશની સગવડો તથા સુવિધાઓનું વર્ણન કરવામાં આવેલ છે તેમજ શિડયુલ-૩ માં સમગ્ર "રાજહંસ કોર્નેલો" યોજનાનું વર્ણન કરવામાં આવેલ છે.

- (2) નીચે શિડયુલમાં જણાવેલા વર્ણન તથા વિગતવાળી મિલકત રહેણાંક હેતુ માટે બીજા પક્ષનાએ પહેલા પક્ષનાને વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને પહેલા પક્ષનાએ રહેણાંકના હેતુ માટે સદરહુ મિલકત વેચાણ રાખવાનું નક્કી કરેલ છે. મજકુર મિલકતની કિંમત પક્ષકારો વચ્ચે રૂા. _____/—(અંકે રૂપિયા _____) પુરા નક્કી કરવામાં આવેલ છે. સદરહુ મિલકત હમો લખી આપનાર એક તરફવાળાએ તમો લખાવી લેનાર બીજી તરફવાળાને ઉપર દર્શાવ્યા મુજબ વેચાણ કરવાનું નક્કી કરેલ છે. તે પૈકી બ્યાનની રકમ પહેલા પક્ષનાએ બીજા પક્ષનાને નીચેની વિગતે ચુકવી આપેલ છે.

ચુકવેલ અવેજની વિગત

<u>તારીખ</u>	<u>બેંકનું નામ</u>	<u>ચેક નંબર</u>	<u>રકમ રૂા.</u>
--------------	--------------------	-----------------	-----------------

એ રીતે ઉપર મુજબની વિગતે હમો લખી આપનાર — એક તરફવાળાને તમો લખાવી લેનાર — બીજી તરફવાળાએ ચુકવેલ છે. સદરહુ મિલકતના બાકી રહેતા અવેજની કુલ રકમ નીચે મુજબના હપ્તા, તારીખ અને ટકાવારી પ્રમાણે ચુકવવાનું તમો લખાવી લેનાર — બીજી તરફવાળા સભ્યએ માન્ય અને કબુલ રાખેલ છે.

એ. વેચાણ લેનારે કુલ કિંમતના ૧૦ ટકા પ્રમાણેની રકમ બુકીંગ કરાવતાં સમયે પ્રમોટરને ચુકવી આપવાના રહેશે.

બી. વેચાણ લેનારે કુલ કિંમતના ૩૦ ટકા પ્રમાણેની રકમ બાનાખતના કરાર સમયે પ્રમોટરને ચુકવી આપવાના રહેશે.

સી. વેચાણ લેનારે કુલ કિંમતના ૪૫ ટકા પ્રમાણેની રકમ જે તે બિલ્ડીંગના પ્લીન્થના બાંધકામ પુર્ણ થાય તે સમયે પ્રમોટરને ચુકવી આપવાના રહેશે.

ડી. વેચાણ લેનારે કુલ કિંમતના ૭૦ ટકા પ્રમાણેની રકમ જે તે બિલ્ડીંગના પોડીયમ સ્ટેજ તથા કોલમ બાંધકામ પુર્ણ થાય તે સમયે પ્રમોટરને ચુકવી આપવાના રહેશે.

ઈ. વેચાણ લેનારે કુલ કિંમતના ૭૫ ટકા પ્રમાણેની રકમ જે તે બિલ્ડીંગના આંતરિક દીવાલ, આંતરિક પ્લાસ્ટર, ફ્લોરીંગ તથા બારીઓના બાંધકામ સમયે પ્રમોટરને ચુકવી આપવાના રહેશે.

એફ. વેચાણ લેનારે કુલ કિંમતના ૮૦ ટકા પ્રમાણેની રકમ જે તે બિલ્ડીંગના સેનેટરી ફીટીંગ્સ, સીડી, લીફ્ટ બ્લોક તથા લોબી વિગેરેના બાંધકામ પુર્ણ થાય તે સમયે પ્રમોટરને ચુકવી આપવાના રહેશે.

જી. વેચાણ લેનારે કુલ કિંમતના ૮૫ ટકા પ્રમાણેની રકમ જે તે બિલ્ડીંગના બાહ્ય પ્લમ્બીંગ, બાહ્ય પ્લાસ્ટર, એલીવેશન, વોટર પ્રુફીંગ સહિત ટેરેસના બાંધકામ પુર્ણ થાય તે સમયે પ્રમોટરને ચુકવી આપવાના રહેશે.

એચ. વેચાણ લેનારે કુલ કિંમતના ૯૫ ટકા પ્રમાણેની રકમ લીફ્ટ, વોટર પમ્પસ, ઇલેક્ટ્રીક ફીટીંગ્સ, ઇલેક્ટ્રો-મીકેનિકલ તથા પર્યાવરણીય જરૂરીયાતો

પુર્ણ કરવામાં આવે તેમજ પ્રવેશ માટેની લોબી, પ્લીન્થ પ્રોટેક્શન તથા આજુબાજુના વિસ્તારના પેવીંગ સમયે પ્રમોટરને ચુકવી આપવાના રહેશે.

આઈ. વેચાણ લેનારે કુલ કિંમતના ૧૦૦ ટકા પ્રમાણેની યાને પુરેપુરી રકમ મિલકતનો કબજો સુપ્રત કરવામાં આવે તે સમયે પ્રમોટરને ચુકવી આપવાના રહેશે.

- (3) આ સાટાખતથી વેચાણ આપવા ઠરાવેલી નીચે શિડયુલમાં જણાવેલી મિલકતના ટાઈટલ ચોખ્ખા અને માર્કેટેબલ છે તેમજ બીજા પક્ષનાના શિડયુલવાળી જમીન સંબંધિત હકક, હિત સંબંધિત તમામ કાયદાકીય જરૂરીયાત સંપૂર્ણ રીતે પુરી કરવામાં આવી છે અને તેની ખાતરી બીજા પક્ષનાએ પહેલા પક્ષનાને કારવેલી છે અને બીજા પક્ષના સદરહુ પ્રોજેક્ટનો પ્રત્યક્ષ કબજો ધરાવે છે તેમજ બાંધકામ કરવા અધિકૃત અને સમક્ષ છે.
- (4) બીજા પક્ષના સદરહુ જમીનના કાયદેસરના માલીક અને પ્રત્યક્ષ કબજેદાર છે અને પ્રોજેક્ટ કરવા હકકદાર છે.
- (5) સદરહુ પ્રોજેક્ટમાં બીજા પક્ષનાએ એક બિલ્ડીંગનું આયોજન કરેલ છે અને તેમાં બેઝમેન્ટ પાર્કિંગ, કોમન પાર્કિંગ તથા કુલ્લે ગ્રાઉન્ડ + ૧૨ માળનું બાંધકામ કરવામાં આવનાર છે.
- (6) સદરહુ પ્રોજેક્ટ 'રેરા' હેઠળ રજીસ્ટ્રેશન થયો છે જેનો રજી.નં. _____ તા. _____ ના રોજ નોંધાયેલ છે.
- (7) પહેલા પક્ષના તરફથી જ્યારે માંગણી કરવામાં આવે ત્યારે બીજા પક્ષના પ્રયોજક (Promoter) ધ્વારા એલોટીને શિડયુલવાળી પ્રોજેક્ટની જમીનને લગતા તમામ ટાઈટલના દસ્તાવેજો તેમજ આર્કિટેક્ટ ધ્વારા તૈયાર કરવામાં આવેલ પ્લાનો, ડિઝાઈન અને વિગતવાર લખેલી ખાસ હકીકતો કે જે પ્રયોજક (Promoter) ના આર્કિટેક્ટ, સ્ટ્રક્ચર ડિઝાઈનર તેમજ જે તે અધિકૃત વ્યક્તિઓ ધ્વારા તૈયાર કરવામાં આવેલા હોય તેવા અન્ય દસ્તાવેજો કે જેનો ઉલ્લેખ "રેરા" (Real Estate Regulation and Development Act, 2016) એક્ટમાં કરવામાં આવ્યા હોય, Real Estate Regulation and Development Act, 2016 કે જેને હવે પછી સરળતા ખાતર "રેરા", "સદર કાયદો", "RERA" તરીકે પણ સંબોધવામાં આવેલ છે) અને તેની હેઠળ

બનાવવામાં આવેલા નિયમો અને અધિનિયમોની ચકાસણી પ્રમોટર ધ્વારા એલોટીને કરવા દેવામાં આવેલ છે અને એલોટીને યાને પહેલા પક્ષનાને તે બાબતે સંતોષ થયેલ છે.

- (8) બીજા પક્ષના પ્રમોટરે પ્રોજેક્ટ માટેના પ્લાનો મંજૂર કરાવી તેમજ તે મુજબ બાંધકામની વિકાસ પરવાનગી સુરત મહાનરગપાલિકા પાસેથી, તા..... થી પ્લાન મંજૂરી આપેલ છે. તેમજ આ સાથે બીજા પક્ષના પહેલા પક્ષનાને બાંહેધરી આપી કબુલ કરે છે કે મંજૂર થયેલ લે-આઉટ પ્લાનમાં "રેરા" કાયદાની કલમ-૧૪ મુજબ તથા જે અન્ય કાનુન લાગુ પડતા હોય તેના અનુપાલન સિવાય કોઈ અનઅધિકૃત ફેરફાર કરશે નહીં તેમજ પહેલા પક્ષના બીજા પક્ષનાને બાંહેધરી આપી કબુલ કરે છે કે મંજૂર થયેલ લે-આઉટ પ્લાનમાં 'રેરા' એક્ટની જોગવાઈઓ મુજબ પ્રમોટર ફેરફાર કરી શકશે.
- (9) બીજા પક્ષના પ્રમોટરે પહેલા પક્ષના પાસેથી માંગણી કરવાથી જમીન/બાંધકામનો પ્લાન તેમજ પ્રોજેક્ટનું સ્પેશીફિકેશન તેમજ બીજા પક્ષનાના આર્કિટેક્ટ ધારા કે. ભંડેરી તથા સ્ટ્રક્ચરલ એન્જિનીયર જલીલ એ. શેખ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે તે તથા "રેરા" એક્ટ હેઠળ ઘડવામાં આવેલ નિયમો તથા અધિનિયમો એલોટી યાને કે પહેલા પક્ષનાએ તપાસેલ છે અને તે બાબતે એલોટીને સંપૂર્ણ સંતોષ છે.
- (10) બીજા પક્ષના ધ્વારા મજકુર પેરા-૧ માં વર્ણન કરવામાં આવેલ જમીન ઉપર જે સુચિત પ્રોજેક્ટનું આયોજન કરી બાંધકામ કરવામાં આવનાર / છે આવેલ છે તેની ઉપર પ્રમોટરના જાણવા તથા માનવા મુજબ કોઈ કાનુની કાર્યવાહી કે, મુકદ્દમો અદાલતમાં પડતર નથી. તેમજ સક્ષમ અધિકારીઓએ આપેલ તમામ મંજૂરી ચાલુ અને અમલમાં છે. તેમજ પ્રમોટરે સદર પ્રોજેક્ટ વાળી જમીન બાબતે કોઈપણ ત્રાહિત વ્યક્તિ કે, પક્ષકાર સાથે વેચાણ કરાર કરેલ નથી. તેના માલિકી બાબતે તેમજ ટાઈટલની સ્થિતિ દર્શાવતા રેવન્યુ દફતરના તમામ ઉત્તરા અને દસ્તાવેજોની અધિકૃત નકલો તથા પ્રમોટર યાને બીજા પક્ષનાના એડવોકેટ ધ્વારા આપવામાં આવેલ ટાઈટલ રીપોર્ટ વિગેરેની અધિકૃત નકલો એલોટીને આપવામાં આવેલ છે અને વેચાણ રાખનાર ધ્વારા પોતે જાતે તથા તેમના કાયદાના જાણકાર વ્યક્તિ પાસેથી સંપૂર્ણ

રીતે તે તમામ બાબત તપાસવામાં આવેલ છે અને તે બાબતે એલોટીને સંપૂર્ણ સંતોષ છે.

- (11) બીજા પક્ષનાએ મંજૂર થયેલ પ્લાન તેમજ બાંધકામની પરવાનગી પ્રમાણે સુચિત પ્રોજેક્ટનું બાંધકામ ચાલુ કરેલ છે અને તે બાંધકામ પુર્ણ થયેથી મકાન વપરાશનું પ્રમાણપત્ર (બીયુસી) તથા કબજાનું પ્રમાણપત્ર મેળવવામાં આવશે.
- (12) આ કરારમાં કારપેટ એરિયાનો અર્થ એપાર્ટમેન્ટનો યાને કે ચોખ્ખો વપરાશ યોગ્ય ક્ષેત્રફળ છે તેમાં આંતરિક ભાગલા પાડતી દિવાલના ક્ષેત્રફળના સમાવેશ થશે પરંતુ તે ક્ષેત્રફળમાં બહારની દિવાલો, સર્વિસ લાઈટ વિગેરેનો સમાવેશ નહીં થાય તેમજ તમામ યુનિટ હોલ્ડરના સહીયારા વપરાશ માટેની બાલ્કની, ખુલ્લી અગાસી, સહીયારુ પાર્કિંગના ક્ષેત્રફળનો સમાવેશ થશે નહીં તે હકીકત એલોટી તથા પ્રમોટર બંને કબુલ રાખે છે.
- (13) વેચાણ આપેલ શિડયુલ-૧ માં જણાવેલ મિલકત / યુનિટની કિંમતની ગણતરીમાં જમીનની કિંમત, બાંધકામના ખર્ચાઓ (એપાર્ટમેન્ટ સહિત), એપાર્ટમેન્ટના સામાન્ય વિજળીકરણ તથા પ્રોજેક્ટમાં સામાન્ય વિસ્તારમાં પુરી પાડવામાં આવતી અન્ય અગ્નિશામક સુવિધાઓ તથા બેઝીક કોમન ફેસેલીટીઝ અને એમેનીટીઝની સુવિધાઓના ખર્ચનો સમાવેશ થશે જે હકીકત પહેલા પક્ષના કબુલ રાખે છે, પરંતુ એલોટી પોતાના વેચાણ રાખેલ યુનિટ / મિલકતમાં વિજળી જોડાણ તથા પાણી જોડાણ પોતે પોતાના ખર્ચે પોતાના નામે ડિપોઝીટ ભરી મેળવશે અને જો પ્રમોટર તે રકમ ચુકવીને જોડાણો લીધા હોય તો એલોટી તે તમામ રકમ દસ્તાવેજ થતા પહેલા પ્રમોટરને ચુકવી આપશે તેવી બાંહેધરી એલોટી પ્રમોટરને આપે છે અને જો તે રકમ એલોટી ચુકવી આપવામાં મોડું કરે કે ઈન્કાર કરે તો પ્રમોટર દસ્તાવેજ કરી આપવાનો ઈન્કાર કરી શકશે સહી.
- (14) શિડયુલ-૧ માં જણાવવામાં આવેલ યાને કે પહેલા પક્ષનાને વેચાણ આપવા નક્કી કરેલ યુનિટ/દુકાનનો કારપેટ એરિયા મુજબનું ક્ષેત્રફળ નીચે શીડયુલમાં જણાવ્યા મુજબનું છે, જેની કિંમત ઉપર જણાવ્યા મુજબ નક્કી કરવામાં આવેલ છે અને તે કિંમતમાં યુનિટ સાથે રાસુકા વપરાશ માટે એલોટીના વણવહેંચાયેલા હિસ્સા તરીકે ખુલ્લો પેસેજ, કોમન પાર્કિંગ, ભોંયતળિયે આવેલ કવર્ડ પાર્કિંગના કુલ્લે રાસુકા વપરાશના

એલોટીના ફાળે પડતા વગર વહેંચાયેલા હિસ્સાનો સમાવેશ થઈ જાય છે જે એલોટી ખરીદવા કબુલ રાખે છે.

- (15) આ કરારમાં ઉપર નક્કી કરેલ કુલ વેચાણ કિંમતમાં વધારો કરી શકશે નહીં પરંતુ અપવાદરૂપે સક્ષમ અધિકારી ધ્વારા વિકાસચાર્જના કારણે અથવા વખતોવખત અને સંજોગવશાત જે અન્ય ચાર્જ સક્ષમ અધિકારી ધ્વારા વસુલ કરવામાં આવે યા લાદવામાં આવે અથવા એલોટી ધ્વારા યુનિટની અંદર એલોટીની સુચનાથી કોઈ ફેરફાર કરવામાં આવે કે એલોટીની સુચનાથી એલોટી વતી કોઈ ફેરફાર કે ખર્ચ પ્રમોટર ધ્વારા કરવામાં આવે તો તે અંગેનો સંપૂર્ણ વધારો પ્રમોટર એલોટી પાસેથી લેવા હકકદાર રહેશે અને તેવા કારણોસર વધારો આથી એલોટી પ્રમોટરને ચુકવવાનું કબુલ કરી બાંહેધરી આપે છે.
- (16) એલોટી દ્વારા પ્રમોટરને ઉપર પેરા-૨ માં નક્કી થયા મુજબ પેમેન્ટની ચુકવણીમાં જે ચેક/ડ્રાફ્ટ આપવામાં આવશે તે "રાજહંસ ન્યુટ્રીમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ" ની તરફેણમાં ચુકવવાનો રહેશે. જો એલોટી નિર્ધારિત સમયમાં ચુકવવાપાત્ર રકમ ચુકવવામાં ઢીલ કરે તો ચુકવવાપાત્ર રકમ ઉપર વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ ચુકવવા એલોટી જવાબદાર રહેશે, પરંતુ સોદો રદ કરવો કે વ્યાજ વસુલવું તે અંગેનો નિર્ણય કરવાનો હકક પ્રમોટરનો રહેશે.
- (17) જી.એસ.ટી., કરવેરા તથા અન્ય વેરાઓ વિગેરે જે પ્રમોટરને બાંધકામ સંબંધિત ચુકવવાના હોય તે પ્રમોટર કહે તે પ્રમાણે એલોટીએ જુદાં ચુકવવાના રહેશે. તમામ પ્રકારના બાંધકામ સંબંધિત કરવેરાનો વેચાણ આપેલ મિલકતની વેચાણ કિંમતમાં સમાવેશ થશે નહીં.
- (18) પ્રમોટરને યુનિટ/દુકાનમાં જડિત વસ્તુઓ (ફિક્ચર્સ) યાને ઈલેક્ટ્રીફિકેશન (જેમાં વાયરીંગ અને સ્વીચ બોર્ડનો સમાવેશ થઈ જાય છે), લોખંડનું શટર આપેલ છે તેમાં પ્રમોટર કાયદાની જાગવાઈ મુજબ સાધારણ ફેરફાર કે પરિવર્તન કરી શકશે અથવા એલોટીને જરૂર જણાય તે મુજબ ફેરફાર કે પરિવર્તન પણ એલોટી પ્રમોટરની સંમતિ લઈ અને તે અંગેનો વધારાનો ખર્ચ ચુકવી ફેરફાર કે પરિવર્તન કરી શકશે. ફ્લોરીંગ, સેનેટરી, ફીટીંગ તથા અન્ય સુવિધાઓની સામગ્રી પ્રમોટર પોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે તથા આઈ.એસ.આઈ.ના સ્ટાન્ડર્ડવાળી ઉપયોગ કરશે. જે તમામ ફીક્ચર્સ વીગેરેની માહિતી, કવોલીટી તથા કઈ કઈ વસ્તુ પ્રમોટર ફીક્ચર્સમાં

આપશે તે વસ્તુઓ બાબતે સંપૂર્ણ માહિતી પ્રમોટરે એલોટીને આપેલ છે અને તેનાથી એલોટી સંતુષ્ટ થયેલ છે.

- (19) સામાન્ય સુવિધામાં તથા સામાન્ય વપરાશમાં તેમજ રાસુકા વપરાશના વિસ્તારમાં ખુલ્લુ પાર્કિંગ, બેઝમેન્ટ પાર્કિંગ, ૩ લીફ્ટ, ફ્લોરીંગ, કોમન ટોયલેટ બાથરૂમ, સીસીટીવી કેમેરા સાથેની સીસ્ટમ, કોમન ઇલેક્ટ્રીફીકેશન, કોમન એરીયા જનરેટર, ફાયર સેફ્ટીની સામગ્રી વિગેરેને તમામ હેતુ માટે અવિભાજ્ય એકમ તરીકે સમજવામાં આવશે તેમજ સદર પ્રોજેક્ટ જમીન સહિતનો એક સ્વતંત્ર, સ્વયં પર્યાપ્ત પ્રોજેક્ટ છે અને તેમામ હેતુ માટે એલોટીનો જે અવિભાજ્ય હકક છે તે વિભાજીત કે અલગ થઈ શકશે નહીં.
- (20) આખી યોજનાની બહારી વિસ્તારમાં આયોજકો દ્વારા થાંભલાઓ ઉપર જુદાં જુદાં બોર્ડ લગાડવામાં આવના રહે અને તે થાંભલા, બોર્ડ અને તેને આનુસંગિક તમામ વસ્તુઓનો માલિકી હકક તથા તે જુદાં જુદાં બોર્ડ લગાડી તેની જે કંઈ વ્યવસ્થા અંગેના તમામ હકકો આયોજકના રહેશે અને તે અંગેનો ઇલેક્ટ્રીક મીટર વિગેરે આયોજા જુદું રાખશે અને તેની પાછળ થતાં ખર્ચાઓ પણ આયોજકે ભોગવવાના રહેશે. તેમાં યુનિટ હોલ્ડરો કે એસોસીએશનનું કોઈ હસ્તક્ષેપ રહેશે નહીં. તેમજ યુનિટ હોલ્ડરોનો કે એસોસીએશનનો તેમાં કોઈપણ પ્રકારનો હકક, હિત, હિસ્સો નથી તેમજ વેચાણ આપેલ મિલકતમાં તે બોર્ડો, થાંભલાઓ વિગેરેનો સમાવેશ થતો નથી.
- (21) પ્રમોટર દ્વારા સહકારી મંડળીના કાયદા/કંપનીના કાયદા/એસોસીએશન/મંડળીમાં પ્રમોટર યોજનાનું જે નામ આપે તે મુજબ યોજનાની નોંધણી કરવા માટે કાર્યવાહી કરવામાં આવે ત્યારે તથા તેની નોંધણી માટે અરજી/ડેકલેરેશન તથા જરૂરી કાગળ એલોટીને મોકલવામાં આવે ત્યારે એલોટીએ તમામ અરજી, સોગંદનામા, જરૂરી દસ્તાવેજો તેમજ કાગળો મોકલ્યેથી ૭ દિવસમાં સહી કરી પ્રમોટરને પરત કરવાના રહેશે. જેથી પ્રમોટર તે અરજી વીગેરેની કાર્યવાહી એલોટી સહિત ફ્લેટ હોલ્ડરોની સામાન્ય સંસ્થાની નોંધણી માટે યોગ્ય સમયમાં રજુ કરી શકે. જો સક્ષમ અધિકારી દ્વારા મુસદ્દારૂપી બાયલોઝ નિયમ કે નિયમનમાં ફેરફાર કરવામાં આવે તો એલોટી તેમાં વાંધા કે તકરાર લઈ શકશે નહીં અને તેવા નિયમો એલોટીને બંધનકર્તા રહેશે.

- (22) આથી એલોટી પાસેથી વ્યાજબી લેણાપાત્ર હોય કે, કોઈપણ આ કરારમાં જણાવેલી રકમ વસુલ કરવા કે, સરભર કરવા માટે એલોટી પ્રમોટરને આથી બાંહેધરી આપે છે અને તે માટે પ્રમોટરને અધિકૃત કરે છે. પ્રમોટર પોતાની વિવેકબુદ્ધિ અનુસાર તેવી કોઈપણ રકમ સરભર કે, વસુલ કરી શકશે અને તે બાબતે એલોટી કોઈ વાંધો, માંગણી કે સુચના પ્રમોટરને આપી શકશે નહીં.
- (23) સમય આ કરારમાં એક અગત્યનું તત્વ છે. પ્રમોટરે પ્રોજેક્ટ સમયસર પરીપુર્ણ કરવાનો રહેશે અને પ્રોજેક્ટ પરીપુર્ણ થયેથી ઓક્યુપન્સી પ્રમાણપત્ર/કમ્પ્લીશન સર્ટીફિકેટ બળ્યા બાદ એલોટીને યુનિટના કબજાની સોંપણી તમામ લેણી રકમ મળ્યેથી કરી શકશે તેમજ એલોટીઓના એસોસીએશનને સામાન્ય સુવિધાઓની સોંપણી કરી આપશે. પરંતુ એલોટીએ પણ નિયમિતરીતે પ્રમોટરને હપ્તાની રકમ તેમજ અન્ય દેવાપાત્ર રકમ સમયસર ચુકવી આપેલી હોવી જોઈએ. પરંતુ જો સંપુર્ણ બાંધકામ પુરું થઈ ગયું હોય અને ઓક્યુપન્સી/કમ્પ્લીશન સર્ટીફિકેટ મેળવવામાં સરકારી વહીવટ કારણોસર કે અન્ય કારણોસર ઢીલ થાય તો પ્રમોટર એલોટીને કબજો સંભાળી લેવા માટે જાણ કરશે અને તે સંજોગોમાં જે કાંઈ અવેજ બાકી હોય તે તમામ અવેજ, ટેક્ષ, મેઈન્ટેનન્સ, જુદાં જુદાં સરકારી વેરાઓ, ખર્ચ, વોટર ચાર્જ, વિજળી ચાર્જ તેમજ દસ્તાવેજ નોંધણી માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટી, નોંધણી ફી, કાયદાકીય ખર્ચા, વકીલ ફી તથા અન્ય ખર્ચની રકમ વિગેરે ચુકવવાપાત્ર તમામ રકમો એલોટીએ પ્રમોટરને ચુકવી આપી તરત જ વેચાણ દસ્તાવેજ કરાવી કબજો સંભાળી લેવાનો રહેશે. લેણાંપાત્ર કોઈપણ રકમ પ્રમોટરને ચુકવવાની બાકી હોય તો તે સંજોગોમાં પ્રમોટર કબજો સોંપણી કરવા તેમજ વેચાણ દસ્તાવેજ કરી આપવા ઈન્કાર કરી શકશે.
- (24) વેચાણ આપેલ મિલકત વપરાશ તથા કબજા માટે તૈયાર છે તેવી એલોટીને લેખિત જાણ થયેથી એલોટી જરૂરી ક્ષતિપૂર્તી કરી બાંહેધરી આપી તેમજ આ કરારમાં જણાવેલ બાકી રહેતી રકમો તથા દસ્તાવેજો સહી કરી દિન-૧૫ માં મિલકતનો કબજો લેશે. જો કોઈ સંજોગોમાં એલોટી કબજો લેવામાં નિષ્ફળ જાય કે કબજો નહીં લે તો જોગવાઈ પ્રમાણે એલોટી દિન-૧૫ બાદ લાગુ પડતાં મેઈન્ટેનન્સ ચાર્જ વિગેરે જરૂરી ચાર્જ ચુકવવાની જવાબદારી એલોટી ઉપર શરૂ થશે. તેમજ જ્યારે એસોસીએશન અથવા સોસાયટીની રચના થાય ત્યાં સુધી એલોટી તેવા મેઈન્ટેનન્સ વિગેરેના ખર્ચા પ્રમોટરને ચુકવી આપશે અને એસોસીએશન અથવા મંડળીની રચના થયેથી

પ્રમોટરે લીધેલી તેવી રકમ એસોસીએશનમાં કે મંડળીમાં તબદીલ કરી દેવાની રહેશે અને પ્રમોટર તેવાં મેઈન્ટેનન્સ તેમજ વ્યાજ વિગેરેની રકમ દરમહીને વસુલ કરી શકશે સહી.

- (25) પ્રમોટરે વેચાણ આપેલ મિલકતનો કબજો એલોટીને વેચાણ દસ્તાવેજ વખતે સોંપી દેવાનો રહેશે. જો પ્રમોટર ઠરાવેલા સમય પ્રમાણે પ્રોજેક્ટ સંપૂર્ણ કરવામાં યાને કે વેચાણ આપેલ મિલકતનો કબજો સોંપવામાં નિષ્ફળ નિવડે તે સંજોગોમાં જો એલોટીએ પોતાનો સોદ્દો રદ ન કરવો હોય તો પ્રમોટર કબજો સોંપી આપે ત્યાં સુધી પ્રમોટરે સ્વીકારેલી રકમ ઉપર વાર્ષિક ૯ ટકાના દરે વ્યાજ પ્રમોટરે એલોટીને ચુકવવાનું રહેશે. તેમજ જો એલોટી અવેજના કે અન્ય દેવાં પાત્ર રકમ પ્રમોટરને ચુકવવામાં ઢીલ કરે તો તે સંજોગોમાં પ્રમોટર ચુકવેલી અનામત/બ્યાનાની ૧૦ ટકા રકમ જપ્ત કરી સોદ્દો રદ કરી શકશે અને જો પ્રમોટર તેમ ન ઈચ્છે તો તે સંજોગોમાં જે સમયે રકમ ચુકવવાની હોય તે તારીખથી ૯ ટકાના દરે વ્યાજ એલોટી પાસેથી મેળવવા હકકદાર રહેશે. જો લડાઈ, અછત, અગ્નિ, સાઈકલોન, ધરતીકંપ, રો-મટીરીયલ્સની અછત, પાણીની અછત, હુલ્લડ, તોફાન અથવા કુદરતી આફત, અકસ્માતના કારણે સ્થાવર પ્રોજેક્ટનો નિયમિત વિકાસ શક્ય ન હોય અથવા સરકાર, કોઈ જાહેર સક્ષમ અધિકારી અથવા કોઈ કોર્ટની સુચના કે હુકમ, નિયમ કે જાહેરાતના કારણે મોડું થાય તેમ હોય તો તે સંજોગોમાં સમયમર્યાદામાં પ્રમોટર વધારો કરવા માટે હકકદાર રહેશે અને તવી વધારેલી સમયમર્યાદાના કારણે એલોટી કોઈપણ જાતનું વ્યાજ, ખર્ચ કે નુકસાનની રકમ પ્રમોટર પાસેથી માંગવા હકકદાર રહેશે નહીં. તેમજ એલોટી આથી કબુલ કરે છે કે, જો ઉપર જણાવ્યા મુજબના કારણો તેમજ કુદરતી આફતના કારણે પ્રોજેક્ટનો અમલ થઈ શકે તેમ ન હોય તો એલોટમેન્ટ રદ થયેલ ગણવામાં આવશે અને રદ થયાની તારીખથી ૧૨ (બાર) માસમાં પ્રમોટરે અવેજ તેટે મેળવેલી રકમ વગર વ્યાજે પરત કરવાની રહેશે અને રકમ પરત મળ્યાથી એલોટીએ પ્રમોટર વિરૂધ્ધ કોઈ હકક, દાવો કે કલેઈમ કરવાના રહેશે નહીં અને પ્રમોટર આ કરાર હેઠળની તમામ જવાબદારી તથા બાંહેધરીમાંથી મુક્ત ગણાશે સહી.

- (26) પ્રમોટર ફ્લેટનો કબજો તા. ૩૧/૧૨/૨૦૨૩ નાં રોજ અથવા તો તે પહેલા સોંપી આપશે. જો પ્રમોટર ઠરાવેલ સમય (શિડયુલ) પ્રમાણે સંપૂર્ણ કરવામાં તથા એલોટીને ઓફિસ/દુકાન સોંપવામાં નિષ્ફળ નિવડે તથા એલોટીને જો તે પ્રોજેક્ટમાંથી

પોતાનો ઓફિસ/દુકાન રદ ન કરવો હોય તો પ્રમોટર કબજો સોંપી આપે ત્યાં સુધી તેને મળેલ તમામ રકમ ઉપર ૯% દરે મુજબ વ્યાજ ચુકવશે. તેમજ એલોટી પણ જો ચુકવણામાં ઢીલ કરે તો જે મુદ્દતે રકમ ચુકવવાની હોય તે તારીખ પછી ૯% દરે વ્યાજ ચુકવવાનું રહેશે.

- (27) એલોટી નકકી થયા પ્રમાણે હપ્તાની રકમ ચુકવવામાં નિષ્ફળ જશે તો પ્રમોટર પોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે એલોટીને નોટીસ આપે નોટીસનો અમલ એલોટી નહીં કરે તો પ્રમોટર કરાર રદ કરી શકશે. તેમજ પ્રમોટર એલોટીની તરફેણમાં વેચાણ આપેલ મિલકતની ફાળવણી રદ કરી શકશે અને બુકિંગ રકમ તેમજ પ્રમોટરને થયેલ નુકસાની તથા અન્ય હિસાબ સરભર કરવા પાત્ર રકમ તથા પ્રમોટરે જો કોઈ રકમ લેવાપાત્ર હોય તે બાદ કરી એલોટીને બાકીની રકમ કરાર રદ થયાના દિન-૯૦ (નેવું)માં પરત કરવાની રહેશે.
- (28) પ્રમોટર કે એલોટી દ્વારા કોઈપણ આ કરારમાં જણાવેલા સંજોગોમાં અથવા અન્ય સંજોગોમાં નોટીસ આપી અથવા અન્ય રીતે શરતભંગના કારણે સોદો રદ થાય તે સંજોગોમાં પક્ષકારો વચ્ચે થયેલાં કરાર યાને સાટાખત વિગેરે પણ આપોઆપ રદ થાય અને તે વખતે પ્રમોટર જે તે ફ્લેટ અન્ય ગ્રાહકને વેચાણ આપવા હકકદાર રહેશે અને તે સંજોગોમાં નવા ગ્રાહક કે પ્રમોટર વિરૂદ્ધ એલોટી કોઈપણ પગલાં લેવાં હકકદાર રહેશે નહીં.
- (29) રૈરા એક્ટની જોગવાઈ પ્રમાણે એલોટી પ્રોજેક્ટમાં થયેલ તેનું એલોટમેન્ટ યાને કે આ કરાર રાજી ખુશીથી, સ્વેચ્છાએ રદ કરવા અથવા પરત ખેંચવા હકકદાર રહેશે, પરંતુ તે સંજોગોમાં એલોટીએ પ્રમોટરને તે મુજબની દરખાસ્ત મુકયેથી પ્રમોટર એલોટમેન્ટ માટે ચુકવાયેલ અનામતની રકમ જપ્ત કરવા અધિકૃત રહેશે અને અનામતની રકમ પ્રોસેસ ચાર્જ તથા નુકશાનીની રકમ બાદ કરી બાકીની ચુકવાયેલ રકમ પ્રમોટર રદ કર્યાની તારીખથી ૧૨ (બાર) માસમાં વ્યાજ કે નુકશાનીની માંગણી વગર પરત કરશે.
- (30) યોજનાના બેઝમેન્ટમાં કાર પાર્કિંગ તથા ટુ વ્હીલર માટે પાર્કિંગ રાખવામાં આવેલ છે જેનો તમામ યુનિટ હોલ્ડરોએ રાસુકો વપરાશ કરવાનો રહેશે.

(31) આ લેખથી એલોટી પ્રમોટરને નીચે મુજબની બાંહેધરી આપે છે. જેનો અમલ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ થાય ત્યાં સુધી તથા ત્યારબાદ લાગુ પડે તે રીતે એલોટીએ કરવાનો રહેશે તેમજ નીચે જણાવેલ વિગતો એલોટી કબુલ કરે છે અને બંધાય છે.

1. મિલકતનો કબજો સંભાળ્યા બાદ એલોટીએ કબજાની તારીખથી પોતાના ફ્લેટનો પોતાના ખર્ચે સારી તથા યોગ્ય રહેવા લાયક સમારકામ થઈ શકે તેવી સ્થિતિમાં રાખશે.
2. એલોટી પોતાની મિલકતમાં જોખમી તથા સળગી ઉઠે તેવાં કોઈ પદાર્થ રાખશે નહીં. એલોટીની બેદરકારી અથવા અજ્ઞાનતાને કારણે મિલકતના કોઈપણ સામાન્ય કે સહીયારા વપરાશના હિસ્સાને નુકસાન થાય તો તેની ક્ષતિ માટે તથા તેનાં ખર્ચ પરિણામ માટે એલોટી જવાબદાર રહેશે.
3. મિલકતના આંતરિક તથા બાહ્ય સમારકામ તથા તેની યોગ્ય સ્થિતિમાં સાચવણી એલોટીના પોતાના ખર્ચે કરશે તથા સંબંધિત સ્થાનિક સત્તા કે સત્તાધિકારીના નિયમ, નિયમન વિગેરેનો ભંગ નહીં થાય તેની કાળજી લેશે. તેવા ભંગ માટે જવાબદારી એલોટીની રહેશે તથા નુકસાની ભરપાઈ પણ તેઓએ કરી આપવાની રહેશે. તેમજ સ્લેબ, બીમ કોલમમાં કોઈ કટીંગ, તોડફોડ, ફેરફાર કે કોઈપણ છેડછાડ એલોટીએ કરવા-કરાવવાની નથી.
4. મિલકતનો કબજો સંભાળ્યા બાદ એલોટીએ કબજાની તારીખથી પોતાના ખર્ચે સારી તથા યોગ્ય રહેવા લાયક સમારકામ થઈ શકે તેવી સ્થિતિમાં રાખશે. મિલકતનો કબજો સ્વીકાર્યા બાદ મિલકતની જાળવણી સાચવણી માટે એલોટી જાતે સંપૂર્ણ જવાબદાર રહેશે તથા તેનાં પોતાના ખર્ચે તે સારી રીતે સમારકામ કરી સારી સ્થિતિમાં રાખશે. કોઈ કાયદા કે કોઈ સત્તાધિકારીના નિયમોનું ઉલ્લંઘન થાય તે રીતે મિલકતમાં બદલાવ કે ફેરફાર અથવા વધારા કરી શકશે નહીં. મિલકતને કે સહીયારી મિલકતને નુકસાન થાય તે રીતે સુધારા કે ફેરફાર કરી શકશે નહીં, તેની દિવાલ તથા વિભાજક દિવાલો, ગટર, મોરી, પાઈપ અને તેને લગતા તમામ વસ્તુઓને સારી તેમજ યોગ્ય રીતે સમારકામ થઈ શકે તેવી સ્થિતિમાં રાખશે. તેમજ તે સારી તથા યોગ્ય સ્થિતિમાં રાખશે.

5. પ્રોજેક્ટમાં આવેલ તમામ મિલકતો કે તેના કોઈ ભાગને નુકસાન થાય તે રીતે સુધારા કે ફેરફાર કરી શકશે નહીં. જો ભવિષ્યમાં રીપેરીંગ વિગેરે કરવાનો થાય ત્યારે મિલકતનો ટેકો, છાપરા વિગેરે કોઈ રીતે નુકસાન પામે નહીં અથવા તો જોખમ ન થાય તેમ રાખશે. એલોટી વધુમાં બાંહેધરી આપી ખાત્રી તથા જવાબદારી લે છે કે, તે મિલકતના મોખરાના ભાગ ઉપર અથવા મુખ્ય દ્વારે અથવા પ્રોજેક્ટના અથવા મિલકતના બાહ્ય હિસ્સામાં બદલાવ નહીં કરે, એલોટી તદ્દપરાંત મિલકતના બહારનાં હિસ્સામાં કોઈપણ સ્થળે બહારની દિવાલોમાં તથા બાહ્ય વિભાગના દિવાલમાં અથવા બારીઓમાં રંગકામમાં બદલાવ અથવા બહારના એલીવેશનમાં કે યોજના કે રૂપરેખામાં કોઈપણ જાતનો ફેરફાર તેમજ આખી મિલકતના બાહ્ય દર્શનમાં કોઈ અઘટીત ફેરફાર કરી શકશે નહીં.
 6. એલોટી યોજનામાં કે વેચાણ રાખેલ મિલકત કે તેના કોઈ ભાગમાં ગંદકી થાય કે તેની ખુલ્લી જગ્યામાં ગંદકી થાય તેવા પ્રકારના કચરાં તથા ઍઠવાડ તથા કોઈ નકામી વસ્તુ તેમાં રાખશે નહીં અથવા ફેંકશે નહીં.
 7. મકાનને સંબંધિત સ્થાનિક સત્તાવાળા અથવા સરકાર દ્વારા માંગણી થયેલ અનામતની રકમ તેમજ વિજળી અને પાણી સંબંધિત એલોટીના ફાળે આવતી તમામ અનામતના હિસ્સાની રકમ, પ્રમોટર દ્વારા માંગણી થયેથી પંદર દિવસમાં એલોટી ચુકવી આપશે.
 8. સ્થાનિક સત્તા અથવા સરકાર દ્વારા અથવા અન્ય કોઈ જાહેર સત્તા એપાર્ટમેન્ટના વપરાશ માટે અથવા કોઈ અન્ય હેતુ માટે સ્થાનિક કરવેરા, વોટર ચાર્જ, વિમાના પ્રિમીયમની રકમ તથા તે પ્રકારની તમામ લાદવામાં આવેલ રકમમાં કાંઈ વધારો થાય તો પોતાના હિસ્સા પુરતી જે રકમ આવે તે એલોટી ચુકવી આપશે.
- (32) વેચાણ કરાર મુજબ ફ્લેટ/યુનિટની કામગીરી, ગુણવત્તાની પ્રમોટરની જવાબદારી કે બાંધકામની કોઈ ક્ષતિ રહી ગઈ હોય તેવાં હિસ્સામાં એલોટી કબજો મેળવેથી **પાંચ વર્ષમાં** પ્રમોટરના ધ્યાન ઉપર લાવશે અને જો શક્ય હોય તો તેવી ખામી પ્રયોજક દ્વારા સુધારી આપવામાં આવશે, પરંતુ તેવી કોઈ ક્ષતિ કે ખામી એલોટીને કે એલોટીના કારીગરો, આર્કિટેક્ટ, ઈન્ટીરીયર ડીઝાઈનર વિગેરેનાઓની બેદરકારીના કારણે થયેલ હોય તો તેવી ખામી કે ક્ષતિ દુર કરવાની જવાબદારી પ્રયોજકની

રહેશે નહીં. એવી ખામીઓ કે જે વર્કમેનશીપની ખામીઓ કે એવી ખામીઓ કે સેવાઓ જે પ્રયોજકના કંટ્રોલની બહાર હોય તેવી ખામીઓ કે સેવાઓ માટે પ્રયોજક જવાબદાર રહેશે નહીં.

- (33) આથી એલોટી કબુલ કરી બાંહેધરી આપે છે કે યોજનાના ફ્લેટ/યુનિટના હોલ્ડરો એટલે કે એસોસીએશન ઓફ એલોટી દ્વારા નિમણુંક થયેલ મેઈન્ટેનન્સ એજન્સી દ્વારા નક્કી કરવામાં આવેલ મેઈન્ટેનન્સ ચાર્જની સંપૂર્ણ રકમની ચુકવણીને આધિન કોમન એરીયા તથા કોમન એમેનીટીસ તેમજ ફેસિલીટીઝના વપરાશનો હકક એલોટીનો રહેશે. તેમજ એસોસીએશન ઓફ એલોટી દ્વારા નક્કી થયેલ શરતો તથા ઠરાવાનું પાલન એલોટી દ્વારા કરવામાં આવશે.
- (34) તેમજ એલોટી દ્વારા આથી બાંહેધરી આપવામાં આવે છે કે પ્રમોટર/મેઈન્ટેનન્સ એજન્સી/એસોસીએશન ઓફ એલોટી અથવા તેમના એજન્ટ કે અધિકૃત વ્યક્તિઓને રાસુકા વપરાશની જગ્યાઓમાં એટલે કે કોમન વિસ્તા, રોડ-રસ્તા વિગેરે તથા તેની આસપાસના વિસ્તારમાં એટલે મેઈન્ટેનન્સ સેવા પુરી પાડવા માટેના હકક રહેશે તથા એલોટી કબુલ કરે છે કે એસોસીએશન ઓફ એલોટી, મેઈન્ટેનન્સ એજન્સીને અગાઉથી યોગ્ય સુચના આપ્યા બાદ તથા સામાન્ય કામગીરીના સમયમાં અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ ખામીનું નિરીક્ષણ કબવા માટે વેચાણ રાખેલ મિલકતમાં પ્રવેશ આપશે.
- (35) "રાજહંસ કોર્નેલો" યોજનામાં વિજળી સબસ્ટેશન, ટ્રાન્સફોર્મર, ઈલેક્ટ્રોનિક એરિયા, ભુગર્ભ પાણીના ટાંકા, ધાબાના ટાંકા, પમ્પ એરિયા, મેઈન્ટેનન્સ વિગેરેનો એરિયા પ્રમોટર દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને તેમાં પ્રમોટર કે એસોસીએશન/સોસાયટી દ્વારા નક્કી કરેલ અધિકૃત વ્યક્તિઓ સિવાય કોઈપણ વ્યક્તિ કે એલોટી પ્રમોટર કે એસોસીએશન/સોસાયટીની પરવાનગી વગર પ્રવેશ કરી શકશે નહીં.
- (36) એલોટીએ વેચાણ લીધા બાદ ફ્લેટમાં આંતરિક સમારકામ તથા તેની યોગ્ય સ્થિતિમાં સાચવણી પોતાના ખર્ચે તથા તે બાબતે સંબંધિત સ્થાનિક સત્તાધિકારી પાસેથી જે કાંઈ પરવાનગી લેવાની હોય કે જે કાંઈ નિયમો હોય તે તમામ નિયમોનું એલોટીએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ તેવાં નિયમોનો ભંગ નહીં થાય તેની એલોટીએ તકેદારી રાખવાની રહેશે તેમજ નિયમોનું ઉલ્લંઘન થાય તે રીતે ફ્લેટમાં એલોટીએ કોઈપણ ફેરફાર કે સુધારાવધારા કરી શકાશે નહીં. જો તેમ છતાં જો

નિયમો, કાયદા કે હુકમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તે માટેની જવાબદારી, નુકસાન, ખર્ચ અને પરિણામ એલોટીના શિરે રહેશે. એલોટી ધ્વારા ફ્લેટમાં કોઈપણ દિવાલ દુર કરી શકાશે નહીં. તેમજ વિજળી, પાણીનું કનેક્શન, ઈન્ટરનેટ કનેક્શન માટેની જગ્યા, પ્લાન વિગેરે બાબત પણ એલોટીએ પ્રમોટર પાસેથી સમજી લીધેલ છે જેથી ભવિષ્યમાં અન્ય ફ્લેટ હોલ્ડરોને કે એસોસીએશન ઓફ એલોટીને અડચણરૂપ થાય કે ખલેલ પહોંચે તે રીતે કોઈપણ કનેક્શનો કે વાયરો કે પાઈપલાઈનો પસાર કરવાની રહેશે નહીં અને જો તેમ કરવામાં આવશે તો તે અંગે થયેલ નુકસાન કે હાનિની જવાબદારી એલોટીની રહેશે તેમજ તે સંજોગોમાં એસોસીએશન ઓફ એલોટી જે કોઈપણ પગલાં ભરે તે એલોટીને કબુલ, મંજૂર અને બંધનકર્તા રહેશે.

- (37) એલોટી દ્વારા સામાન્ય રીતે લાગુ પડતાં તમામ કાનુનો, નિયમો, નિયમનો, જાહેરાતો તેમજ આ પ્રોજેક્ટ માટે બનાવવામાં આવેલ ખાસ નિયમો તથા બાબતોની જવાબદારી તથા તેનું પાલન કરવાની બાંહેધરી આપી આ સાટાખત કરેલ છે તેમજ વધુમાં એલોટી બાંહેધરી આપે છે કે વેચાણ લીધેલ ફ્લેટ સંબંધિત જે તે સક્ષમ અધિકારીઓ દ્વારા જે કોઈ જરૂરિયાત અધિગ્રહણ, માંગણી, સમારકામ વિગેરેની જરૂરિયાત ઉત્પન્ન થાય તો તે એલોટીએ પોતાના ખર્ચે કરવાની રહેશે.
- (38) આ કરાર કર્યા બાદ પ્રમોટર વેચાણ આપેલ દુકાન ગીરો મુકી શકશે નહીં કે તેના ઉપર કોઈ બોજો ઉત્પન્ન કરી શકશે નહીં પરંતુ જો તેવા કોઈ ગીરો કે બોજો પ્રમોટર ધ્વારા કરવામાં આવે તો એલોટીના હકક અને હિતને અસરકર્તા રહેશે નહીં અને તે ગીરો કે બોજો પ્રમોટરે પોતાના ખર્ચે દુર કરવાનું રહેશે.
- (39) જ્યાં સુધી આ કરાર ઉપર બંન્ને પક્ષકારો સહી કરી સબ-રજીસ્ટ્રાર સમક્ષ એલોટીના ખર્ચે નોંધણી નહીં થાય ત્યાં સુધી આ કરારની શરતો પ્રમોટરને બંધનકર્તા રહેશે નહીં. તેમજ જો એલોટી આ કરાર કર્યા બાદ જણાવેલ પેમેન્ટ ચુકવે નહીં અથવા તો એલોટીએ ચુકવેલ પ્રથમ ચેક/ઈન્સ્ટ્રુમેન્ટ નકરાય તો તે સંજોગોમાં પણ આ કરારની શરતો પ્રમોટરને બંધનકર્તા રહેશે નહીં અને તે સંજોગોમાં જ્યાં સુધી બંન્ને પક્ષકારો ફરીથી સદર કરાર બંન્નેની સહીથી અમલમાં ન મુકે ત્યાં સુધી સદર કરાર બિનઅમલી બનશે તેનો કોઈ અમસ કરી કરાવી શકાશે નહીં.
- (40) આ સાટાખત/કરારમાં પક્ષકારો એકબીજાની સંમતિથી સુધારોવધારો કે ફેરફાર કરી શકશે સહી.

(41) આ કરાર તેમજ તેની શરતો બંન્ને પક્ષકારો વચ્ચે એવી રીતે સમજવામાં આવેલ છે તેમજ કબુલ રાખવામાં આવેલ છે કે આ કરારમાં સમાવિષ્ટ તમામ જોગવાઈઓ તથા તેની રૂએ પ્રોજેક્ટ સંબંધિત ઉત્પન્ન થતી તમામ બાંહેધરીઓ તથા જવાબદારીઓ ઉત્તરોત્તર એલોટીઓને લગુ પડશે. એટલે કે એલોટી જો અન્ય કોઈ વ્યક્તિને સદર મિલકત તબદીલ કરવાના કિસ્સામાં આ કરારમાં એલોટીએ આપેલ તમામ બાંહેધરીઓ તથા નક્કી કરવામાં આવેલ તમામ શરતો પણ વેચાણ સાથે નવા ખરીદનારને બંધનકર્તા રહેશે અને ઉત્તરોત્તર નવા ખરીદનારે પણ તેનું પાલન કરવાનું રહેશે.

(42) આ કરારની શરતો કે જે લાગુ પડતાં કાયદા હેઠળ રદપાત્ર હોય તે શરતો પક્ષકારોને લાગુ પડશે નહીં અને આ કરારના હેતુ માટે કોઈ શરતો વ્યાજબી રીતે અસંગત હોય તેટલે સુધી સુધારેલ અથવા રદ થયેલ સમજવામાં આવશે.

(43) જ્યારે જ્યારે પ્રમાણસર ખર્ચ યુનિટ હોલ્ડરોએ ભોગવવાનો આવે તે વખતે દુકાનના કુલ કારપેટ એરિયાના પ્રમાણસરના ભોગવટા અનુસાર એલોટીએ ખર્ચની ગણતરી કરી ઠરાવ્યા મુજબ ભોગવવાનો રહેશે.

(44) પ્રમોટર દ્વારા રજુઆત તથા ખાતરી :

એ. પ્રમોટર આથી જાહેર કરે છે કે આજની તારીખે, પરિયોજનાની જમીન માટે ઉપલબ્ધ ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ) માત્ર ૫૨૫૬ ચો.મી. જ છે અને પ્રમોટરે પ્રિમિયમની ચુકવણી કર્યેથી ઉપલબ્ધ બનતા ટી.ડી.આર. અથવા એફ.એસ.આઈ. અથવા વિકાસ નિયંત્રણ નિયમન (ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન)માં જણાવ્યા મુજબની જુદી જુદી યોજનાઓના અમલ દ્વારા પ્રોત્સાહક એફ.એસ.આઈ. તરીકે ઉપલબ્ધ એફ.એસ.આઈ. અથવા ભવિષ્યમાં, વિકાસ નિયંત્રણ નિયમનોમાં ફેરફાર થવાથી અપેક્ષિત વધુ એફ.એસ.આઈ. મળશે, એવા તર્કના આધારે – આ ચારેય બાબતો ઉક્ત પરિયોજનાને લાગુ પડે છે. ૭૮૮૩.૩૪ ચો.મી. એફ.એસ.આઈ. વાપરવાનું આયોજન કર્યું છે. ઉક્ત પરિયોજનામાં પ્રમોટરે, પરિયોજનાની જમીન પર તેમણે ૭૮૮૩.૩૪ ચો.મી. એફ.એસ.આઈ.નો ઉપયોગ કરવાનું વિચાર્યું છે અને એલોટી, સુચિત એફ.એસ.આઈ.નો ઉપયોગ કરીને પ્રમોટર સુચિત બાંધકામ કરવાના છે અને બિલ્ડીંગનું વેચાણ કરવાના

છે એ આધારે તેમજ જાહેર કરવામાં આવેલા સુચિત એફ.એસ.આઈ. માત્ર પ્રમોટરની માલિકીનો જ રહેશે એવી સમજના આધારે ઉક્ત બિલ્ડીંગ ખરીદવા સંમત થયા છે.

બી. મકાનનું બાંધકામ પુરું થયા બાદ અને સક્ષમ સત્તા મંડળ દ્વારા ભોગવતા પ્રમાણપત્ર આવ્યા બાદ પ્રમોટર, કારપેટ એરીયામાં કોઈ ફેરફાર થયો હોય તો તેની વિગતો રજુ કરીને, એલોટીને આપવામાં આવેલા આખરી કારપેટ એરીયાને પૃષ્ઠિ આપશે, પરંતુ કારપેટ એરીયામાં થયેલો ફેરફાર ૩ % થી વધુ હોવો જોઈશે નહીં. પ્રમોટર દ્વારા આવી પૃષ્ઠિ આપવામાં આવ્યા બાદ કારપેટ એરીયાની કુલ કિંમતની પુનઃ ગણતરી કરવાની રહેશે. કારપેટ એરીયામાં થયેલો ઘટાડો નિર્ધારિત મર્યાદાની અંદર હોય તો પ્રમોટર એલોટીએ ચુકવેલ વધુ નાણાં એલોટીએ આવા વધુ નાણાં જયારથી ચુકવ્યા હોય તે તારીખથી ૬% ના દરે વાર્ષિક વ્યાજ સાથે ૪૫ દિવસની અંદર રીફંડ કરશે. એલોટીને આપવામાં આવેલા કારપેટ એરીયામાં કોઈ વધારો થાય તો પ્રમોટર ચુકવણી ન કરવામાં આવેલ આયોજનના ત્યારપછીના સીમાસ્તંભ (માઈલસ્ટોન) મુજબ એલોટી પાસેથી વધારાની રકમની માંગણી કરશે. આ તમામ નાણાંકીય ગોઠવણો, આ કરારના ખંડ ૧(ક)માં થયેલી સમજુતી મુજબ ચો.મી. દીઠ સમાન દરે કરવાની રહેશે.

(45) સદરહુ બિલ્ડીંગમાં આવેલ તમામ પાર્કિંગવાળી જગ્યા બીજા પક્ષનાને કે અન્ય કોઈને પણ ફાળવવામાં આવેલ નથી અને રાસુકા વપરાશની સુવિધાઓ અને ફાળવવામાં આવેલ જગ્યાઓમાં સોસાયટીના દરેક સભ્યોનો વણવહેંચાયેલો હિસ્સો રાખવામાં આવેલ છે.

(46) આ કરાર ની કોઈપણ જોગવાઈ, ઉક્ત અધિનિયમ અથવા તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો અને વિનિયમો હેઠળ અથવા લાગુ પડવાપાત્ર અન્ય કાયદાઓ હેઠળ રદ કરવા અથવા બિનઅમલપાત્ર બનાવવાનું નક્કી કરવામાં આવે તો, આવી જોગવાઈઓ, તે આ કરારના હેતુ સાથે અસંગત હોય એટલા પુરતી અને આ અધિનિયમ અથવા તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો અથવા લાગુ પડતા કાયદાઓ સાથે તે અનુરૂપ હોવી જરૂરી હોય તેટલા પ્રમાણમાં તે સુધારાયેલી અથવા રદ થયેલી ગણાશે અને આ કરારની બાકીની જોગવાઈઓ, આ કરારના અમલ વખતે લાગુ પડતી હતી એ જ રીતે માન્ય અને અમલપાત્ર રહેશે.

- (47) સદરહુ બિલ્ડીંગમાં આવેલ તમામ પાર્કિંગવાળી જગ્યા બીજા પક્ષનાને કે અન્ય કોઈને પણ ફાળવવામાં આવેલ નથી અને રાસુકા વપરાશની સુવિધાઓ અને ફાળવવામાં આવેલ જગ્યાઓમાં સોસાયટીના દરેક સભ્યોનો વણવહેંચાયેલો હિસ્સો રાખવામાં આવેલ છે.
- (48) પ્રમોટર અને એલોટી વચ્ચે જ્યારે વેચાણ દસ્તાવેજ કરવાનો વખત આવે અથવા તે પહેલા જો કોઈ લખાણ, સુધારાનો કરાર કે અન્ય લખાણ કરવાનું થાય તો તે સહી કરવાનું સ્થળ પ્રમોટર દ્વારા નક્કી કરવામાં આવશે અને નોંધણીના સમયે લાગુ પડતી સબ-રજીસ્ટ્રાર કચેરીને જરૂરી પક્ષકારોએ હાજર રહેવાનું રહેશે તેમજ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ વખતે પ્રમોટર દ્વારા અથવા તેના અધિકૃત વ્યક્તિ દ્વારા લાગુ પડતી સબ-રજીસ્ટ્રાર કચેરીમાં સહી કર્યાની કબુલાત આપશે અને વેચાણ દસ્તાવેજ કરવાની કાર્યવાહીમાં જ્યાં જ્યાં પ્રમોટરની જરૂરિયાત પડે ત્યાં ત્યાં પ્રમોટર કે તેના અધિકૃત વ્યક્તિએ સહી તથા હાજરી આપવાની રહેશે.
- (49) આ કરારમાં એલોટી અને પ્રમોટરના નામ સાથે સરનામા પણ લખેલાં છે અને તે સરનામા ઉપર પક્ષકારોએ પત્ર વ્યવહાર કરવાનો રહેશે. તેમજ આ કરાર થયા બાદ સદર સરનામાઓમાં ફેરફાર થાય તો એલોટી તથા પ્રમોટરે એકબીજાને તે અંગેની જાણ કરવાની રહેશે અને જો તેમ કરવામાં કોઈપણ પક્ષકાર નિષ્ફળ જાય તો તે સંજોગોમાં સદર સરનામાઓ ઉપર કરવામાં આવેલ પત્રવ્યવહાર યોગ્ય રીતે જે તે પક્ષકારને મળેલ છે તેમ સમજવામાં આવશે. જો કોઈ સંજોગોમાં જો એકથી વધુ જોઈન્ટ એલોટી હોય તે કિસ્સામાં જેનું નામ પ્રથમ હોય તે એલોટીને તેણે આપેલ સદર સરનામું પત્ર વ્યવહાર કરવામાં આવશે અને તે વખતે તમામ હેતુ માટે તમામ એલોટીને યોગ્ય રીતે પત્ર કે ટપાલ મોકલવામાં આવી છે તેવું ગણાશે.
- (50) આ કરાર, વેચાણ દસ્તાવેજની સ્ટેમ્પ ડ્યુટી, નોંધણી ખર્ચ, ડ્રાફ્ટીંગ ખર્ચ, વકીલ ફી, સ્ટેશનરી ખર્ચ, નોંધણી ફી તથા સોદા દરમ્યાન કરવા પડતાં અન્ય કોઈ કરાર કે કાર્યવાહી અંગે થયેલ ખર્ચ તેમજ લીગલ કોસ્ટ, એલોટીએ ભોગવવાની રહેશે.
- (51) આ કરાર તથા તેમાં થયેલી શરતો સંબંધે ઉત્પન્ન થનાર કોઈ વિવાદ જેમાં અર્થઘટન, શરતોની માન્યતા, સંબંધિત પક્ષકારોના હકક તથા જવાબદારીઓ વિગેરે બાબત અરસપરસ સંમતિથી ઉકેલવામાં આવશે તથા તેમાં નિષ્ફળ થયેથી "રેરા" એક્ટ તથા

તે હેઠળ નિયમો તથા નિયમન હેઠળ નીમવામાં આવેલ નિવેડા અધિકારી દ્વારા નિકાલ કરવામાં આવશે.

- (52) સદરહુ મિલકતનો કબજો આ સાટાખતની રૂએ તમો પહેલા પક્ષનાને સુપ્રત કરવામાં આવેલ નથી અને સદરહુ મિલકતનો પ્રત્યક્ષ કબજો બીજા પક્ષનાએ પહેલા પક્ષનાને રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ વખતે સુપ્રત કરવાનો રહેશે.
- (53) સદરહુ મિલકત પહેલા પક્ષનાએ આ સાટાખતની રૂએ અન્ય કોઈને ટ્રાન્સફર, તબદીલી કરાવવાની રહેશે નહીં પરંતુ એલોટીના હકકોને બાધ ન આવે તેવી રીતે પ્રમોટર પ્રોજેક્ટ, જમીન, યુનિટોનું વેચાણ કરી શકશે તેમજ પોતાના હકકો તબદીલ કરી શકશે.
- (54) સદરહુ મિલકતના વેચાણ બાબતે પહેલા પક્ષનાએ બીજા પક્ષનાએ વધારાની કેટલીક શરતો જણાવેલી છે જેનો ઉલ્લેખ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજમાં કરવામાં આવશે. તે શરતો પણ પહેલા પક્ષનાને બંધનકર્તા રહેશે અને તેને આધિન હાલનો સાટાખત કરી આપેલ છે.
- (55) બીજા પક્ષના કંપની – રાજહંસ ઈન્ફ્રાકોન (ઈ) પ્રા. લિ. – વતી આ સાટાખતમાં સહી કરવા માટે કંપનીની બોર્ડ ઓફ ડીરેક્ટર્સની મીટીંગમાં કંપનીના એક અધિકૃત વ્યક્તિ **મનહરભાઈ મંછુભાઈ કંથારીયા**, જાતના : હિન્દુ, ઉ.આ.વ.: ૫૩, ધંધો : નોકરી, રહેવાસી : સિધ્ધાર્થ ચોક, ગામ : ડભોલી, સુરતનાંને કંપનીની બોર્ડ ઓફ ડીરેક્ટર્સની મીટીંગમાં થયેલ ઠરાવ અનુસાર સત્તા અને અધિકાર આપવામાં આવેલ છે.
- (56) નીચે શીડ્યુલમાં જણાવેલી મિલકત અંગેના આ સાટાખતની સ્ટાંપ ફી, સર્વિસ ટેક્ષ, જીએસટી, વકીલ ફી વિગેરે તમામ ખર્ચ પહેલા પક્ષનાએ ભોગવવાનો છે અને રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની સ્ટાંપ ફી, સર્વિસ ટેક્ષ, જીએસટી, રજીસ્ટ્રેશન ફી, વકીલ ફી વિગેરે તમામ આનુષંગિક ખર્ચ પણ પહેલા પક્ષનાએ ભોગવવાનો છે સહી તે અંગે બીજા પક્ષનાની કોઈ જવાબદારી રાખવામાં આવી નથી.

—:: શિડ્યુલ — ૧ ::—

—//વેચાણ આપવા ઠરાવેલી મિલકતની વિગત//—

શહેર સુરત, તાલુકો મજુરાના મોજે ગામ પીપલોદના

રેવન્યુ સરવે નંબર—૬૪/૧/પૈકી ૨, ૬૪/૧/પૈકી ૩ તથા ૬૪/૧/પૈકી ૪ થી નોંધાયેલી બીનખેતીની

જમીન કે જેનું સંયુક્ત ક્ષેત્રફળ ૪૩૦૫ સમયોરસમીટર છે તે જમીનને ટી.પી.સ્કીમ નંબર-૬ (પીપલોદ) લાગુ પડતાં ફાયનલ પ્લોટ નંબર-૪૭ તથા ઓરીજીનલ પ્લોટ નંબર-૧૪/એ ફાળવવામાં આવેલ, જેનું ફાયનલ પ્લોટ મુજબનું ક્ષેત્રફળ ૨૮૪૭ ચો.મી. વાળી બીનખેતીની જમીન તથા શહેર સુરત, તાલુકો મજુરાના મોજે ગામ પીપલોદના રેવન્યુ સરવે નંબર-૬૨/પૈકી ૨, ૬૨/પૈકી ૩, ૬૨/પૈકી ૪ તથા ૬૨/પૈકી ૫ થી નોંધાયેલી બીનખેતીની જમીન કે જેનું સંયુક્ત ક્ષેત્રફળ ૪૩૫૬ સમયોરસમીટર છે તે જમીનને ટી.પી.સ્કીમ નંબર-૬ (પીપલોદ) લાગુ પડતાં ફાયનલ પ્લોટ નંબર-૬૪ તથા ઓરીજીનલ પ્લોટ નંબર-૧૫ ફાળવવામાં આવેલ, જેનું ફાયનલ પ્લોટ મુજબનું ક્ષેત્રફળ ૩૦૩૨ ચો.મી. વાળી બીનખેતીની જમીન, એમ કુલે મળીને ૫૮૭૮ ચો.મી. પૈકી સબ-પ્લોટ નંબર : ૧ કે જેનું ક્ષેત્રફળ ૨૮૨૦ ચો.મી. વાળી બીનખેતીની જમીનો ઉપર બાંધવામાં આવેલ રાજહંસ કોર્નેલો એ નામથી આળખાતી યોજનામાં ફ્લોર પર આવેલ યુનિટ/ફ્લેટ નંબર :, જેનું કારપેટ એરીયા મુજબનું ક્ષેત્રફળ ચો.મી. અને બિલ્ટઅપ એરીયા મુજબનું ક્ષેત્રફળ ચો.મી. છે તે મિલકત તથા તળની જમીનમાં વણ વહેંચાયેલા ચો.મી. હિસ્સાની જમીન સહિતની મિલકત તથા તેના લાગતા વળગતા અંદરના તથા બહારના તમામ હકકો સહિતની મિલકત.

મજકુર આખી યોજનાની ચર્તુદ્દિશા નીચે મુજબ છે :

ઉત્તરે :

દક્ષિણે :

પૂર્વે :

પશ્ચિમે:

--:: શિડયુલ - ૨ ::--

--// રાસુકા વપરાશની સગવડો અને સુવિધાઓની વિગત //--

- એ. ખુલ્લું પાર્કિંગ
- બી. ૩ ફ્લોર બેઝમેન્ટ પાર્કિંગ
- સી. ૩ લીફ્ટ
- ડી. ફ્લોરીંગ
- ઈ. કોમન ટોયલેટ બાથરૂમ
- એફ. સીસીટીવી કેમેરા સાથેની સીસ્ટમ
- જી. કોમન ઈલેક્ટ્રીફીકેશન
- એચ. કોમન એરિયા જનરેટર

આઈ. ફાયર સેફ્ટીની સામગ્રી

—:: શિડયુલ — ૩ ::—

—//રાજહંસ કોર્નેલો એ સમગ્ર યોજના/ઈમારતની વિગત//—

શહેર સુરત, તાલુકો મજુરાના મોજે ગામ પીપલોદના રેવન્યુ સરવે નંબર-૬૪/૧/પૈકી ૨, ૬૪/૧/પૈકી ૩ તથા ૬૪/૧/પૈકી ૪ થી નોંધાયેલી બીનખેતીની જમીન કે જેનું સંયુક્ત ક્ષેત્રફળ ૪૩૦૫ સમયોરસમીટર છે તે જમીનને ટી.પી.સ્કીમ નંબર-૬ (પીપલોદ) લાગુ પડતાં ફાયનલ પ્લોટ નંબર-૪૭ તથા ઓરીજીનલ પ્લોટ નંબર-૧૪/એ ફાળવવામાં આવેલ, જેનું ફાયનલ પ્લોટ મુજબનું ક્ષેત્રફળ ૨૮૪૭ ચો.મી. વાળી બીનખેતીની જમીન તથા શહેર સુરત, તાલુકો મજુરાના મોજે ગામ પીપલોદના રેવન્યુ સરવે નંબર-૬૨/પૈકી ૨, ૬૨/પૈકી ૩, ૬૨/પૈકી ૪ તથા ૬૨/પૈકી ૫ થી નોંધાયેલી બીનખેતીની જમીન કે જેનું સંયુક્ત ક્ષેત્રફળ ૪૩૫૬ સમયોરસમીટર છે તે જમીનને ટી.પી.સ્કીમ નંબર-૬ (પીપલોદ) લાગુ પડતાં ફાયનલ પ્લોટ નંબર-૬૪ તથા ઓરીજીનલ પ્લોટ નંબર-૧૫ ફાળવવામાં આવેલ, જેનું ફાયનલ પ્લોટ મુજબનું ક્ષેત્રફળ ૩૦૩૨ ચો.મી. વાળી બીનખેતીની જમીન, એમ કુલ મળીને ૫૮૭૯ ચો.મી. પૈકી સબ-પ્લોટ નંબર : ૧ કે જેનું ક્ષેત્રફળ ૨૮૨૦ ચો.મી. વાળી બીનખેતીની જમીનો ઉપર બાંધવામાં આવેલ રાજહંસ કોર્નેલો એ નામથી આળખાતી યોજનાવાળી મિલકત.

૩ બેઝમેન્ટ ફ્લોર:- દાદર, લીફ્ટ, ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ પાર્કિંગ, અંડર ગ્રાઉન્ડ વોટર ટ્રેક વિગેરે.

ગ્રાઉન્ડ ફ્લોર :- દાદર, લીફ્ટ, પેસેજ, વરંડો, ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ પાર્કિંગ વિગેરે તેમજ યુનિટો કે જે પ્લાનમાં બતાવેલાં છે.

પહેલા માળથી

બારમા માળ :- પેસેજ, દાદર, કોમન ટોઈલેટ/વોશરૂમ, લીફ્ટ તથા યુનિટો વિગેરે પ્લાનમાં દર્શાવ્યા મુજબ.

મજકુર યોજનાની ચર્તુદિશા નીચે મુજબ છે :

ઉત્તરે :

દક્ષિણે :

પૂર્વે :

પશ્ચિમે :

ઉપરની વિગતો આ વેચાણ દસ્તાવેજ હમોએ હમારી રાજીખુશીથી તથા અકકલ હોશીયારીમાં વાંચી, વંચાવી, સમજી, વિચારી, કોઈના કોઈપણ જાતના દાબ—દબાણ કે પ્રલોભન વિના તન અને મનની સ્વસ્થ અને સાવધ અવસ્થામાં, બીનકેફ હાલતમાં તમોને કરી આપ્યો છે જે હમોને કબુલ, મંજૂર અને બંધનકર્તા છે સહી અને થાય સહી અને રહેશે સહી.

અત્રે.....મતુ તત્રે.....શાખ

રાજહંસ ઈન્ફ્રાકોન (ઈ) પ્રા. લિ. વતી

તેના અધિકૃત વ્યક્તિ :

મનહરભાઈ મંદુભાઈ કંથારીયા

.....

.....

.....